

प्रकरण-३

नियम संग्रह-२

अधिकारीओ अने कर्मचारीओनी
सत्ता अने कुराओ

પ્રકરણ-૩ નિયમ સંગ્રહ-૨

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

૩.૧ નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજોની વિગત:-

(૧) હોદ્દો - નિયામક
(વહીવટી સત્તાઓ)

વહીવટી વર્ગ-૩ તથા વર્ગ-૪ની નિમણૂક તથા બઢતી વર્ગ-૧ અને વર્ગ-૨ ની નિમણૂક તથા બઢતી નિવૃત્તિ/સ્વૈચ્છિક નિવૃત્તિની દરખાસ્તો વહીવટી વિભાગમાં મોકલવી, પેન્શન કેસ, ખાતાકીય પરીક્ષા યોજવી, મુક્તિ આપવી, અધિકારી/કર્મચારીઓ સામેની ફરીયાદ પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ અંગેની કામગીરી:-

- (૧) વર્ગ-૨ ના અધિકારીઓની ૨૪૦ દિવસ સુધીની બંધાજ પ્રકારની રજા માટે નોંધ પર મંજૂરી આપવી.
- (૨) ગ્રાન્ટ-ઇન-એઈડ કોડ ૧૯૯૨ હેઠળ ચાલતી સ્વૈચ્છિક સંસ્થા/કચેરીઓને વાર્ષિક ગ્રાન્ટ ગણતરી કરાવવી, ગ્રાન્ટ ગણતરી મુજબ ગ્રાન્ટ છુટી કરવી તેમના લગતા પ્રશ્નોમાં યોગ્ય નિરાકરણ કરવું તથા નિવૃત્ત થતાં કર્મચારીઓને નિયમાનુસાર કાર્યવાહી કરી બહાલી આપવી. ધી રાઈટ ઓફ પર્સન્સ વીથ ડીસેબીલીટી એક્ટ-૨૦૧૬ અન્વયે દિવ્યાંગક્ષેત્રે કાર્યરત સંસ્થા કચેરીઓને લાયસન્સ આપવું, નિરીક્ષણ અહેવાલ રજૂ કરાવવા અને વિભાગ કક્ષાએ દરખાસ્તો મોકલવી, ભારત સરકારને લગતા પ્રોજેક્ટની ચકાસણી કરી ભલામણ સહીત દરખાસ્ત મોકલવી. સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સમયાંતરે નિરીક્ષણ કરવું અને વાર્ષિક નિરીક્ષણના પ્રોગ્રામ તૈયાર કરાવવાનો અમલ કરવો.

નાણાકીય સત્તાઓ:-

- નાણા વિભાગ દ્વારા સોંપાયેલી સત્તાની મર્યાદામાં અંદાજપત્રીય અનુદાન અને પુનઃવિનિયોગની વહેંચણી અને પુનઃવહેંચણી.
- અનુદાન અને વિનિયોગની પુનવિનિયોગ બાંધકામ માટે નાણાનો પુનવિનિયોગ, મકાન બાંધકામ પેશગી (ગુજરાત નાણાકીય નિયમ-૯૨)
- ખાતાના વડાના હોદ્દાની રૂએ સોંપાયેલી નાણાકીય સત્તાઓ મકાન પેશગી, મોટર સાયકલ, સ્કૂટર પ્રકારના નાના વાહનો, સ્વયંસંચાલિત સાયકલ, મોપેડ અને આવા અન્ય વાહનોની પેશગી (ગુજરાત નાણાકીય નિયમ ૧૦૩-૧૧૩ (૧)).
- આવર્તક ખર્ચ દરેક કેસમાં વાર્ષિક ૧૦,૦૦૦
- અનાવર્તક ખર્ચ દરેક કેસમાં વાર્ષિક ૪૦,૦૦૦
- કોમ્પ્યુટર, જેરોક્ષ મશીન, ફેક્ટિંગ મશીનો, ફેક્સ મશીન, પ્રિન્ટરો તેમજ આનુસંગિક સાધનો જેવા કચેરી માટેના અન્ય સાધનો પુરા પાડવા.
- વાહનોની મરામત મોટરકાર અને જીપની મરામત (છૂટા ભાગોની કિંમત સહિત) પાણી પુરવઠો, વીજળી વગેરે માટે ખર્ચ જેવું અન્ય કાયમી ખર્ચ.
- તાબાના કર્મચારીઓની બાબતમાં ગુજરાત નાણાકીય નિયમોના નિયમ-૧૬૧માં નિયત શરતોને આધિન રહીને સંપૂર્ણ સત્તા.
- વિમાઈડ અને બચત ફંડની રકમ ચૂકવવાની મંજૂરી આપવી, (જૂથવીમા યોજના ૧૯૮૧ના નિયમો આધિન).

સમાજ સુરક્ષા ખાતામાં વધતી જતી કામગીરી અને જવાબદારીને પહોંચી વળવા તથા નિયામકશ્રીને મહત્વની કામગીરીમાં મદદરૂપ થઈ શકે તે માટે નાયબ નિયામકની જગા મંજૂર કરવામાં આવેલ છે.

(૨) નાયબ નિયામક વહીવટ:-

(વહીવટી સત્તાઓ)

- વર્ગ-૩ તથા વર્ગ-૪ ની નિમણૂક તથા બઢતી અંગે નોંધ ઉપર નિયામકશ્રીની મળ્યા બાદ આદેશ બહાર પાડવા.
- વર્ગ-૩ અને વર્ગ-૪ નાં કર્મચારીઓની બઢતી અને બદલી અંગેની કામગીરી.
- વર્ગ-૧ થી વર્ગ-૪ સુધીના પગાર નક્કી કરવા.

- તબીબી ભથ્થું, તબીબી રીએમ્બર્સમેન્ટ, ટ્રાયબલ એલાઉન્સ, ચાર્જ એલાઉન્સ, પરિવહન ભથ્થું વિગેરે, વર્ગ-૩ અને વર્ગ-૪ માટે મંજૂરી આપવી.
- વર્ગ-૩ અને વર્ગ-૪ ના પેન્શન કેસ તૈયાર કરવા અંગેની કાર્યવાહી.
- વર્ગ-૩ અને વર્ગ-૪ ની પ્રવર્તતા યાદી કરવી.
- સેવાઓને લગતા કોર્ટ કેસોને લગતી તમામ કાર્યવાહી.
- વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓ સામેની ફરીયાદ, પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ અંગેની સમગ્ર પ્રક્રિયા પુરી કરી વર્ગ-૩ અને ૪ ના કેસોમાં તપાસનો આખરી નિર્ણય લેવો. (નિયામકશ્રી પરામર્શ સાથે)
- વર્ગ-૨ થી વર્ગ-૪ ના અધિકારી / કર્મચારીઓની ૨૪૦ દિવસ સુધીની (અસાધારણ રજા સિવાયની) અન્ય બધા જ પ્રકારની રજાઓ મંજૂર કરવી) વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓની ૫૪૦ દિવસ સુધીની અસાધારણ રજાઓ મંજૂર કરવાની કાર્યવાહી.

(૩) નાયબ નિયામક - વૃદ્ધ પેન્શન-

- નિરાધાર વૃદ્ધો અને અશક્તોને આર્થિક સહાય યોજના અંગેની કામગીરી.
- ભારત સરકારની રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકોટ મોચન યોજના) અને રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અંગેની કામગીરી.
- રાજ્ય સરકાર તરફથી ૧૯૭૮-૭૯ થી નિરાધાર વૃદ્ધોને આર્થિક સહાય યોજનાની શરૂઆતમાં વૃદ્ધને આર્થિક સહાય આપવાની યોજનાનો અમલ થતો આ યોજનામાં અરજદારની આવક મર્યાદામાં રાજ્ય સરકાર દ્વારા વધારો થતા આ યોજનાઓના લાભાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થવા પામેલ છે.
- વધુમાં તા.૧૫-૮-૮૫ થી ભારત સરકારની યોજના અમલમાં આવતા તેની નોડલ એજન્સી તરીકેની કામગીરી આ પ્રભાગને સોંપવામાં આવતા આ બંને ભારત સરકારની યોજનાઓની કામગીરી પણ કરવામાં આવે છે.
- ગ્રાન્ટ ઈન એઈડ ધોરણે મંજૂર થયેલ વૃદ્ધાશ્રમની વહીવટી કામગીરી.

(૪) નાયબ નિયામક - યોજના:-

- પ્રભાગની નવી યોજનાઓ તૈયાર કરવી, તથા ચાલુ યોજનાઓમાં સુધારા વધારા કરવા.
- બજેટને લગતી કામગીરી.
- સરકારી મકાનોને લગતી કામગીરી.
- યુનિસેફ અને ભારત સરકારના મહત્વના કાર્યક્રમના અમલીકરણની કામગીરી.
- ખાતા હેઠળની યોજનાઓનું વિસ્તૃતીકરણ તેમાં સુધારા વધારા તેમજ નવી યોજનાઓ તૈયાર કરવી તથા તેના અમલીકરણ માટે યોજનાકીય માળખું તૈયાર કરી વગેરે કામગીરી માટે આ જગ્યા મંજૂર કરવામાં આવેલ છે. આ જગ્યા મંજૂર થયા બાદ પ્રભાગ હેઠળ નવી સંસ્થાઓની કાયદાકીય જોગવાઈ હેઠળ સ્થાપના અને સંસ્થાઓ માટે કાયદાકીય જોગવાઈ મુજબના મકાનો તૈયાર કરવા, વગેરે કામગીરી.
- રાજ્યમાં ચાલતી વિવિધ યોજનાકીય કામગીરીનું જીલ્લા કક્ષાએ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા અમલીકરણ થાય છે. તે યોજનાનું અમલીકરણ વ્યવસ્થિત હાથ ધરાય છે કે કેમ તથા આ - યોજના હેતુ મુજબ લાભાર્થીઓને તેનો લાભ પુરો પુરો મળે છે કે કેમ તેનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવાની કામગીરી કાયમી ધોરણે આ અધિકારીને સોંપવામાં આવે છે.

(૫) નાયબ નિયામક - (દિવ્યાંગ કલ્યાણ શાખા)

વહીવટી સત્તાઓ :- સ્વૈચ્છિક સંસ્થાના વર્ગ-૩ ના તથા વર્ગ-૪ ની નિમણૂકની બહાલી અંગે નોંધ મંજૂર કરવા અને આદેશ બહાર પાડવા બાબત.

- દિવ્યાંગ કલ્યાણની સ્વૈચ્છિક સંસ્થાઓમાં વર્ગ-૩ અને વર્ગ-૪ સુધીના પગાર મુકકર કરવા (સ્ટેપીંગ અપ અને અનુમાનીત) (ડીમડેઈટ) મંજૂર કરવાની બહાલી આપવા બાબત.
- કર્મચારીઓને તાલીમમાં મોકલવા બાબત વર્ગ-૩ માટે બહાલી આપવી.
- વર્ગ-૩ અને વર્ગ-૪ ના પેન્શન કેસ મંજૂર કરવા .
- કોર્ટકેસ , ટ્રીબ્યુનલ કેસ વગેરેની પત્ર વ્યવહાર તથા તમામ આનુષંગિક કાર્યવાહી, સરકારી તેમજ સ્વૈચ્છિક (ગ્રાન્ટ-ઈન-એઈડ કોડ હેઠળ આવેલ સંબંધિત સંસ્થાઓનું નિરીક્ષણ માટે નિયામકશ્રીના ધ્યાને મુકવું.)
- ધી રાઈટ ઓફ પર્સન્સ વીથ ડીસેબીલીટી એક્ટ-૨૦૧૬ સંદર્ભેની કામગીરી.
- ધી રાઈટ ઓફ પર્સન્સ વીથ ડીસેબીલીટી એક્ટ-૨૦૧૬ હેઠળ નોંધણી કરવી તથા પ્રમાણપત્ર આપવા બાબત.

- ભારત સરકારનાં દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રેના પ્રોજેક્ટ ભલામણ સહિત વિભાગને મોકલવા બાબત.
- એવોર્ડ અરજીઓ મેળવી, એવોર્ડ પસંદગી કરી એવોર્ડ એનાયત કરવા.
- દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત ગ્રાન્ટ ઈન એઈડ સ્વૈચ્છિક સંસ્થાના કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા.
- ઈન્દિરા ગાંધી નેશનલ ડીસેબીલીટી પેન્શન યોજનાના અમલીકરણની કામગીરી
- સંત સુરદાસ યોજનાની અમલીકરણની કામગીરી
- દિવ્યાંગ શિષ્યવૃત્તિ રાજ્ય સરકારની તેમજ ભારત સરકારની શિષ્યવૃત્તિની અમલીકરણની કામગીરી
- દિવ્યાંગ લગ્ન સહાય, દિવ્યાંગ સાધન સહાય, દિવ્યાંગ નિરામયા હેલ્થ ઈન્સયોરન્સ, દિવ્યાંગોને એસ.ટી બસમાં મફત મુસાફરી યોજના, દિવ્યાંગ વીમા સહાય યોજના, વગેરે યોજનાની અમલીકરણની કામગીરી
- બૌદ્ધિક અસમર્થતા ધરાવતી (મનોદિવ્યાંગ) વ્યક્તિને આર્થિક સહાયની યોજનાની અમલીકરણની કામગીરી
- દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત ગ્રાન્ટ ઈન એઈડ સ્વૈચ્છિક સંસ્થાના કર્મચારીના પાંચ વર્ષ પૂર્ણ થતા પુરા પગારમાં સમાવવાની કામગીરી.
- દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત અને નિયામક સમાજ સુરક્ષા દ્વારા ૧૦૦ ટકા ગ્રાન્ટ મેળવતી (ગ્રાન્ટ ઈન એઈડ) સ્વૈચ્છિક સંસ્થાના કર્મચારીના પેન્શનને લગતી, તેમજ કર્મચારીઓના સ્વૈ.નિવૃત્તિ/રાજીનામાં મંજૂર કરવા અંગેની કામગીરી
- નવા નિમણુંક પામેલ કર્મચારીઓને નવ વર્ષિત પેન્શન યોજનામાં સમાવી કાયમી ખાતા નંબર મેળવવા કામગીરી
- LPC ખરાઈ કરી કાઉન્ટર સાઈનની કામગીરી.
- ધી રાઈટ ઓફ પર્સન્સ વીથ ડીસેબીલીટી એક્ટ-૨૦૧૬ અંતર્ગત દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓમાં શિક્ષણ, તાલીમ અને રહેઠાણની સુવિધાઓ આપવામાં આવે છે.

(૬) નાયબ નિયામક - સી.પી.ડી શાખા:-

બાળ ન્યાય(બાળકોની કાળજી અને રક્ષણ) બાબત અધિનિયમ - ૨૦૧૫ હેઠળની કામગીરી

- બાળ કલ્યાણને લગતી સંસ્થાઓના સંચાલન અને નાણાકીય મંજૂરી અંગેની કામગીરી
- પાલક માતા-પિતા યોજના, શેરો પોઝિટીવ ઈલનેશ યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંગેની વહીવટી અને અમલીકરણની કામગીરી
- ભિક્ષા પ્રતિબંધક ધારા હેઠળ ભિક્ષુક ગૃહોના સંચાલન તેમજ વહીવટી કામગીરી .
- દત્તક વિધાન માટે સંકલન અને દેખરેખ કામગીરી
- સ્વૈચ્છિક સંસ્થાઓના સ્ટાફની નિમણુંકની બહાલી વગેરેની કામગીરી .
- બાળ કલ્યાણ ક્ષેત્રની સરકારી અને બિનસરકારી સંસ્થાઓ ગ્રાન્ટ ઈન એઈડ કોડ હેઠળની સંસ્થાઓના નિરીક્ષણ ની કામગીરી
- રાજ્ય સરકારની સ્ટેટ એક્શન પ્લાન ફોર ડ્રૂઝ ડિમાન્ડ રીડકશન યોજનાના અમલીકરણની કામગીરી
- ભારત સરકારની નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રૂઝ ડિમાન્ડ રીડકશન યોજનાનું અમલીકરણની કામગીરી
- ભારત સરકારની બાળ કલ્યાણની યોજનાઓના અમલીકરણ કામગીરી
- જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીઓની મીટીંગની સંકલન કામગીરી અને આયોજન કાર્યવાહીની તમામ કામગીરી
- કેદીસહાય ગ્રાન્ટ ફાળવણી તેમજ તેના રજીસ્ટરોની નિભાવણી
- પ્રચાર-પ્રસારની તમામ કામગીરી
- પ્રોબેશન ઓફ ઓફિન્ડર્સ એક્ટ - ૧૯૫૮ના અમલીકરણની કામગીરી
- બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ - ૨૦૦૬ના અમલીકરણની કામગીરી
- રાજ્ય ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની મીટીંગ બોલાવવા સંબંધી કામગીરી
- રાજ્ય કક્ષાએથી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે કરવાની થતી તમામ કામગીરી
- સમાજ સુરક્ષા સહાયકની કામગીરીની ફાઈલો અને રેકર્ડ નિભાવણી

(૭) હિસાબી અધિકારી વર્ગ-૧ (સરકારી બાબત)

- ઉપાડ અને ચૂકવણી અધિકારીની ફરજો.

- પ્લાન/નોન પ્લાન બજેટ તેમજ બજેટને લગતી સંલગ્ન બાબતો જેવી કે ગ્રાન્ટ ફાળવણી, ખર્ચ, નિયંત્રણ, એ.જી. રીકન્સીલીએશન.
- સરકારી કચેરી/ સંસ્થાઓનું ઓડિટ.
- ખાતા હેઠળના સરકારી કર્મચારીઓના એચ.બી.એ / એમ.સી.એ. ને લગતી બાબતો.
- એ.જી. ઓડિટ, ભૌતિક જથ્થા ચકાસણીને લગતા પેરા, પી.એ.સી.પેરા અને લગતી કામગીરી.
- સરકારી કર્મચારીને જીપીએફ પેશગી પાર્ટફાઈનલ ઉપાડની મંજૂરી અંગેની કાર્યવાહી.
- ખાતા હેઠળના સરકારી કર્મચારી / અધિકારીના ટી.એ.બીલ ચકાસણીની કામગીરી.
- બજેટને લગતી કામગીરી.
- ડીસીબી ચકાસણીની કામગીરી.

(૮) હિસાબી અધિકારી વર્ગ-૨ (ગ્રાન્ટ-ઈન-એઈડ)

- દિવ્યાંગની સ્વૈસંસ્થાઓના કર્મચારીઓનાં પગારની સીધી ચૂકવણી માટે બીલો મંજૂર કરી પગાર ચૂકવવાની કામગીરી.
- દિવ્યાંગોની સંસ્થાઓના કર્મચારીઓના જી.પી.ફંડ એકાઉન્ટ નિભાવવાની કામગીરી.

ડી.પી.સેલ:-

- દિવ્યાંગોની સંસ્થાઓના કર્મચારીઓના સીધા પગારની ચુકવણી શાખા દ્વારા ૧૨૦૦ જેટલા કર્મચારીઓને દરમાસે પગારની ચુકવણી ચેક દ્વારા આપવાના હુકમ થયેલ છે. અને આ સમગ્ર વધારાની કામગીરી સોંપવામાં આવેલ છે.
- સરકારશ્રીએ બે હિસાબી અધિકારીઓ કોમન કેડરના નામ મુજબ ખાતામાં ચુકવામાં આવે છે. તેઓની કામગીરીની વહેંચણી નીચે મુજબ કરવામાં આવે છે.

(૧) ડી.પી.સેલ (દિવ્યાંગ સંસ્થા કર્મચારીઓની પગારની સીધી ચુકવણી)

(૨) સ્વૈચ્છીક સંસ્થાઓને ગ્રાંટ

(૩) સ્વૈચ્છીક સંસ્થાઓની ગ્રાંટ ગણતરીની ચકાસણી

(૪) ઓડીટ શાખા-સરકારી

(૫) કેશ શાખા

(૬) પગાર ધોરણ શાખા

(૭) ડી.સી.બીલ શાખા

(૮) ગ્રાંટ ફાળવણી

નોંધ: સદરહુ બંને અધિકારીઓની કામગીરીમાં ઉત્તરો ઉત્તર વધારો થવા પામેલ છે. ખાતાનું બજેટ પણ વર્ષ વર્ષ વધે છે. ખાતા હેઠળની સર્વ સરકારી/સ્વૈચ્છીક સંસ્થાઓનું નિયમિત ઓડીટ કરવામાં આવે છે. તેમજ બજેટ પણ સમયસર તૈયાર કરવાનું રહે છે. વર્ષની આધાર સુધીમા સ્વૈચ્છીક સંસ્થાઓની મુલાકાત લઈ ગ્રાંટની ગણતરી કરી ચુકવણી પણ સમય મર્યાદામાં કરવાની રહે છે. વધારાની કામગીરી સંસ્થા/કચેરીઓની ઓચિંતી મુલાકાત લઈ ઓડીટની કામગીરી અને હિસાબી નિયમિતતા જોવા સુચના આપેલ છે.

૧. ના.વિ.ના તા. ૨-૧-૮૮ ના મુજબ દરરોજ કર્મચારી દીઠ ૧૮.૬ કેસોનો નિકાલ કરવાનું ઠરાવેલ છે.

૨. ખાતામાં યોજનાઓના પ્રમાણ અને વહીવટી કામગીરીમાં વધારો થતા કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવા પામેલ છે. જેની વિગત નીચે મુજબ છે.

૩. માસિક સરેરાશ કામના દિવસો ૨૫ જેટલા રહે છે. જગ્યાઓ નોટીંગલેન્ડની ભરાયેલ ૨૭ છે. તેને ધ્યાને લેતા $૧૮.૬ * ૨૫ * ૨૭ = ૧૨૫૫.૫$

૪. આ ગણતરી જોતા કાર્યભારનું પ્રમાણ નક્કી કરેલ ધોરણ કરતા વધુ જણાયેલ છે. કચેરીમાં માસિક ૧૩૪૦૦ પત્રોનો નિકાલ થાય છે. આ નિકાલ જોતા સરેરાશ રોજનાં કર્મચારી દીઠ નિકાલ $૧૮ * ૨૫ * ૨૭ = ૧૨૮૨૫$ જેવો થાય છે.

૫. ક્રમ-૨ થી ૭માં જણાવેલ સંવર્ગનાં કર્મચારીઓ નોટીંગલેન્ડ ઉપરાંત ઓડિટ, ગ્રાંટ ગણતરી હિસાબોનું મેળવણુ તથા નિરીક્ષણ અંગેની કામગીરી પણ હાથ ધરે છે. જેમાં પત્રોના નિકાલ કરતા વધુ સમય વ્યતીત થાય છે.

(૯) મદદનીશ-નિયામક જગ્યા(૪)

- મંજૂર જગ્યા-(૪)
- ભરેલી જગ્યા-(૧)
- ખાલી પડેલ-(૩)

૧. મદદનીશ નિયામક (સીપીડી):- નાયબ નિયામકશ્રી (સીપીડી શાખા)ની કામગીરીમાં મદદ કરવી, તેમજ નાયબ નિયામકશ્રીની વહીવટી સત્તાઓના સંદર્ભ મુજબની કામગીરી.

૨. યોજના અધિકારી (મદદનીશ નિયામક સમક્ષ):- નાયબ નિયામકશ્રી (યોજના શાખા)ની કામગીરીમાં મદદ કરવી, તેમજ નાયબ નિયામકશ્રીની વહીવટી સત્તાઓના સંદર્ભ મુજબની કામગીરી.

૩ દિવ્યાંગોના ખાસ અધિકારી(મદદનીશ નિયામક સમક્ષ):- નાયબ નિયામકશ્રી (દિવ્યાંગ કલ્યાણ શાખા)ની કામગીરીમાં મદદ કરવી, તેમજ નાયબ નિયામકશ્રીની વહીવટી સત્તાઓના સંદર્ભ મુજબની કામગીરી.

૪ વહીવટી અધિકારી (મદદનીશ નિયામક સમક્ષ):- નાયબ નિયામકશ્રી (વહીવટ શાખા)ની કામગીરીમાં મદદ કરવી, તેમજ નાયબ નિયામકશ્રીની વહીવટી સત્તાઓના સંદર્ભ મુજબની કામગીરી.

(૧૦) નિરીક્ષક (૪)

ખાતાની કચેરીમા જુદી જુદી સંસ્થાઓ જેવી કે બાળ કલ્યાણ, દિવ્યાંગ કલ્યાણ, બાળ લગ્ન અને પરીવીક્ષા ધારો, પ્રમાણિત સંસ્થા અને શાળાઓ, વૃધ્ધ પેન્શન શાખા, છે. તેઓની મુખ્ય જવાબદારી સંસ્થા કચેરીના નિરીક્ષણ કાર્ય કરવા તેમના એલવાલો મોકલી ફોલોઅપ કામગીરી.

૧) જે તે શાખા હેઠળની સંસ્થાની કે અંતેવાસીઓની ફરીયાદો તપાસી અને તેના ફોલો અપની કામગીરી

(૨) જે તે શાખા હેઠળના સંસ્થાના/કર્મચારીઓના કોર્ટ કેસો અંગેની કામગીરી

(૩) જે તે શાખાની વહીવટી તેમજ નિરીક્ષક કક્ષાની સોંપવામાં આવે તે વધારાની કામગીરી જેવી કે

પારીતોષિક (રાજ્ય તેમજ રાષ્ટ્રીય) તાલીમ કાર્યક્રમો, બહારના સામાજિક કાર્યક્રમો અને સંપર્કો.

(૧૧) ૧. હેડ ક્લાર્ક, ૨. સિનિયર ક્લાર્ક, ૩. જુનિયર ક્લાર્કની કામગીરી ભરતી પ્રક્રિયા, GCSR-2002, સામાન્ય વહીવટ વિભાગના વખતો વખતના નિયમો, ઠરાવો, પરિપત્ર, નોટીફિકેશન પ્રમાણે,

- કર્મચારીઓની લગતી કામગીરી જેવીકે (૧) ઉચ્ચતર પગાર ધોરણ અને પેન્શન કેસો તૈયાર કરવા (૨) સુપ્રિમકોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત કર્મચારીના પેન્શન કેસોની કામગીરી (૩) બજેટ અંગેની કામગીરી અને તેની ચકાસણી, ખાસ અંગભુત યોજનાની ગ્રાન્ટ, કરાર આધારીત કર્મચારીઓના કરાર પુર્ણ થતા નવા કરાર કરવાની કામગીરી (૪) એજી ઓડિટના ફકરાઓનો સમયમર્યાદામાં ખુલાસા રજુ કરવા. (૫) GEM પોર્ટલની કામગીરી (૬) પી.જી.પોર્ટલની કામગીરી (૭) આર.ટી.આઈ એક્ટ-૨૦૦૫, સેવા સેતુ, સી.એમ.ડેસ બોર્ડ, સ્વાગત પોર્ટલ, સાથી સોફ્ટવેર, IFMS.2 (૮) ભરતી તેમજ બઢતી નિયમો બનાવવા, સુધારા કરવા તેમજ સિનિયોરીટી લિસ્ટ બનાવવું જેવી કામગીરી

(૧૨) સિનિયર ક્લાર્ક

- સીનીયર ક્લાર્ક સામાન્ય રીતે કચેરીની હિસાબની કામગીરી સંભાળે છે.અગાઉ યોજનાકીય કામગીરી સામાન્ય રીતે સીનીયર ક્લાર્ક હસ્તક હતી.
- સીનીયર ક્લાર્ક સંવર્ગના કર્મચારીએ હિસાબી કામગીરી જેવી કે દરખાસ્તોના મંજુરીના આદેશ મળ્યેથી કચેરીના કર્મચારીઓના પગાર બિલો, પુરવાણી પગાર બિલો, કન્ટીજન્સી બિલો, તમામ યોજનાનાં બિલો બનાવી તિજોરી કચેરીમાં રજૂ કરી ચેકો મેળવવા. ઉક્ત ચેકો મળ્યા બાદ તેની ચેક રજીસ્ટરમાં નોંધ કરી તેની સંબંધિત વ્યક્તિને રજીસ્ટર એડીથી મોકલવા તેમજ ચૂકવવાની કાર્યવાહી અને આનુસંગીક રજીસ્ટરો નિભાવવાની કામગીરી કરવાની રહેશે. ઓનલાઈન દ્વારા મળતી ફરીયાદોનો નિકાલ જેમ કે PG PORTAL, સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિકાલ કરવાનો રહેશે. GEM PORTAL પરથી આઉટસોર્સ દ્વારા જેમ કે પટાવાળા, ડેટાએન્ટ્રી ઓપરેટર અન્ય ખાલી જગ્યાઓ બાબતે ઓફિસની જરૂરિયાત મુજબની ખરીદી GEM PORTAL પરથી રહેશે. નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગ, ગાંધીનગર દ્વારા માંગવામાં આવતી માહિતી, જિલ્લા કક્ષાએ અલગ-અલગ કચેરી દ્વારા માંગવામાં આવતી માહિતી, વાર્ષિક બજેટ, સી.એમ.ડેસબોર્ડ, NGOની ગ્રાન્ટ, NSAP ની તમામ ઓનલાઈન કામગીરી.

(૧૩) જુનિયર ક્લાર્કની કામગીરી

- શાખાના અધિકારી/કચેરીના વડા દ્વારા સોંપવામાં આવે તે મુજબ તેમના વતી ટપાલોનું ઈનવર્ડ, આઉટવર્ડ તથા ફાઈલોની અવરજવરની નોંધ જેવી કામગીરી કરવી. ૨.અન્ય શાખા અથવા કચેરીમાં મોકલવામાં આવતી ટપાલ, ફાઈલોની આઉટવર્ડની કામગીરી કરવી. તે જ રીતે અન્ય શાખા તથા અન્ય કચેરીમાંથી આવતી ટપાલ, ફાઈલોની આઉટવર્ડની કામગીરી કરવી. તે જ રીતે અન્ય શાખા તથા અન્ય કચેરીમાંથી આવતી ટપાલ તથા ફાઈલોના સ્વીકારની

કામગીરી કરવી. ૩.શાખાના અધિકારી/કચેરીના વડા/તરતના ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવે તેવા વિષયો, ટપાલ તથા ફાઈલો અન્વયે નિયમાનુસારની કાર્યવાહી કરી નિકાલની કામગીરી કરવી. સ્મૃતિપત્રો પાઠવવા અંગેની કામગીરી કરવી.

(૧૪) અંગ્રેજી અને ગુજરાતી સ્ટેનોગ્રાફર:- (૨) આ જગ્યા એકાંકી છે અને રાજ્ય કક્ષાએ આ એકજ જગ્યા છે. તેઓ નિયામકશ્રીની સાથે સીધા સંકળાયેલ છે.

(૧૫) સંશોધન મદદનીશ:- (૨) આ જગ્યાઓ એકાંકી છે અને કોમન કેડરથી આંકડા અને અર્થશાસ્ત્ર બ્યુરો દ્વારા ડેપ્યુટ કરવામાં આવે છે અને આંકડા અને અર્થશાસ્ત્ર બ્યુરોમાં નોર્મસ મુજબ કામગીરી કરવામાં આવે છે.

(૧૫) આંકડા મદદનીશ:- (૧) આ જગ્યા એકાંકી છે.તેઓ જે ખાતાના આંકડાકીય માહિતીની વિગતો રાખવાની રહે છે.

(૧૬) ડ્રાઈવર:- (૨) આ જગ્યાઓ પ્રભાગની ગાડી માટેના ડ્રાઈવરો છે અને તે પ્રભાગના નિયામકશ્રીની અને નાયબ નિયામકશ્રી તથા સ્ટાફકાર તથા ગાડી ચલાવવાની ફરજો બજાવે છે. વાહનો ચાલુ હાલતમાં છે.

(૧૭) કોમ્પ્યુટર ડેટા ઓપરેટર- (૪)

(૧) નાણા વિભાગના તા.૨-૧-૮૮ ના ઠરાવ મુજબ ટાઈપીસ્ટ માટે રોજના શબ્દો ૪૪૨૫ નક્કી થયેલ છે.

(૨) માસિક સરેરાશ કામના દિવસો ૨૫ જેટલા રહે છે. ભરાયેલ ટાઈપીસ્ટની જગ્યા જોતા કાર્યનું ભારણ ૪૪૨૫*૫*૨૫=૫,૫૩,૧૨૫ શબ્દો થાય.

(૩) આ ગણતરી જોતા કાર્ય ભારણ નક્કી કરતા વધુ પ્રમાણ થાય છે અને કચેરીમાં માસિક ૫,૬૦,૦૦૦ શબ્દો ટાઈપીસ્ટ દ્વારા ટાઈપીંગ થાય છે.જે સરકારશ્રીએ નક્કી કરેલ માપદંડ કરતા વધુ જણાય છે.(૫,૬૦,૦૦૦/૫/૨૫=૪૪૮૦) શબ્દો કર્મચારી દીઠ થાય છે.

(૧૮) U D ID ના સ્ટેટ કો-ઓર્ડિનેટર

- U D ID ના સ્ટેટ કો-ઓર્ડિનેટર તરીકે.
- U D ID ના સંબંધી તમામ કામગીરી.
- અત્રેની કચેરી હસ્તકની ટેકનીકલ કામગીરીમાં માર્ગદર્શન અને મુશ્કેલી નિવારણ.
- અત્રેની કચેરી હસ્તકની તમામ પ્રકારની ટેકનીકલ ખરીદી જેવી કે, કોમ્પ્યુટર,પ્રિન્ટર,વેબ કેમેરા,બાયોમેટ્રિક વગેરે જેવી ખરીદી, ઓનલાઈન ખરીદી, જેમ દ્વારા ખરીદી વગેરે રેકર્ડ શાખાના સહયોગથી કરવાની રહેશે.
- વિભાગ દ્વારા બોલાવવામાં આવતી આઈટી કમિટીમાં સંકલન શાખા સાથે સહયોગમાં રહી કામગીરી કરવાની રહેશે.
- ઓનલાઈન સ્કોલરશીપમાં ટેકનીકલ માર્ગદર્શન અને મુશ્કેલી નિવારણ સંબંધી કામગીરી.

(૧૯) આઈ.ટી કન્સલ્ટન્ટ

- ૧. PG પોર્ટલની કામગીરી.
- ૨. CM ડેસ્કબોર્ડની કામગીરી જેમાં શાખાઓ તરફથી રજુ થતી વિગતો અપલોડ કરવા અને તે સંબંધી કામગીરી,(આ કામગીરી દરેક માસની ૭મી તારીખ સુધીમાં પૂર્ણ કરવી અને તેમાં જે શાખા તરફથી માહિતી ન મળે તો નાયબ નિયામક આયોજન અને નિયામકશ્રીનું ધ્યાન દોરવું)
- ૩. PG પોર્ટલમા આપવતી ફરિયાદો જે તે શાખાને ફોરવર્ડ કરવી.
- ૪. સમાજ સુરક્ષા નિયામકશ્રીની વેબસાઈટમાં જરૂરી સુધારા વધારા અને નવી નાહિતી અપલોડ કરવી, વેબસાઈટને અધ્યન કરવી જે અંગે સંબંધિત શાખાઓએ તેમની નવી માહિતી સુધારા-વધારા,યોજનાકીય માહિતી આપવાની રહેશે.
- ૫. સ્વાગત ઓનલાઈનમાં આવતી ફરિયાદો જે તે શાખાને ફોરવર્ડ કરવી.
- ૬. PG પોર્ટલ અને સ્વાગત ઓનલાઈનમાં આવતી ફરીયાદો નિકાલ વગેરેને સ્ટેટસ રિપોર્ટ નાયબ નિયામક વહીવટ અને નિયામકશ્રીને દર ત્રણ દિવસે રજુ કરવો.
- ૭. PM ડેસ્કબોર્ડ, અત્રેની કચેરીની જાહેરાતો, અપલોડ કરવી વગેરે કામગીરી.

(૨૦) ટેકનીકલ આસિસ્ટન્ટ

- આઉટસોર્સ ની એજન્સી દ્વારા અત્રે સેવા પુરી પાડવામાં આવે છે.

(૨૧) કાયદા સલાહકાર

- (૧) આ કચેરીની તમામ શાખાઓ તરફથી નામ.સુપ્રિમકોર્ટ,નામ.હાઈકોર્ટ,સેશન્સ કોર્ટ,સિવિલ કોર્ટ,નામ. ગુ.મુ.સે.ટ્રીબ્યુનલના કેસો સંદર્ભની ફાઈલ કાયદા સલાહકારશ્રીને રજુ કરવાની રહેશે.કાયદા સલાહકારશ્રીએ જરૂરી ચકાસણી કરી અભિપ્રાય સહ ફાઈલ સંબંધિત નાયબ નિયામકશ્રીને રજુ કરવાની રહેશે.
- (૨) આ ખાતાની કામગીરીના સંદર્ભમાં કોઈ બાબતે કાયદાકીય માર્ગદર્શનની જરૂરિયાત ઉપસ્થિત થાય તે કિસ્સામાં જરૂરી માર્ગદર્શન/અભિપ્રાય આપવાનો રહેશે.
- (૩) નામ.સુપ્રિમકોર્ટ, નામ.હાઈકોર્ટ, સેશન્સ કોર્ટ, સિવિલ કોર્ટ, નામ ગુ.મુ.સે.ટ્રીબ્યુનલ કે અન્ય કોર્ટના કેસો સંદર્ભ સંબંધિત કેસની વિગતો ધ્યાને લઈ સંબંધિત કોર્ટમાં હાજર રહી સરકારી વકીલશ્રીને બ્રીફ કરવાની કામગીરી કાયદા સલાહકારશ્રીએ કરવાની રહેશે.તેમજ જરૂરિયાત ઉપસ્થિત થયેથી સંબંધિત કોર્ટમાં જે તે મુદત દરમ્યાન હાજર રહી સરકારી વકીલશ્રીના પરામર્શમાં રહી જરૂરી કાર્યવાહી કાયદા સલાહકારશ્રીએ હાથ ધરવાની રહેશે.